

12 એપ્રિલ 2018

2018 બર્સિંગ સિઝન માટે સીટી ઓફ બ્રેમ્પ્ટન નટ કલાકારો શોધી રહ્યા છે અરજીઓ લેવાનું ચાલુ છે

બ્રામ્પ્ટન, ઓન્ટેરિયો – સીટી ઓફ બ્રેમ્પ્ટન તમામ નટ કલાકારોને 2018 તમાશા સિઝનમાં અરજી કરવા આમંત્રિત કરે છે જેથી શહેર ફરતેના જાહેર સ્થળો જીવંત બનાવી શકાય.

રસ ધરાવતા કલાકારોને જણાવવામાં આવે છે કે [સીટી ગાઈડલાઈન્સ](#) ની સમીક્ષા કરે અને પૂર્ણપણે ભરેલ [અરજી પત્રક](#) સાથે ટૂંકો ઓડિયો અથવા વિડિયો culture@brampton.ca ને રજૂ કરે, અથવા જાતે બ્રેમ્પ્ટન સીટી હોલ ખાતેની ઈકોનોમિક એન્ડ કલ્ચર ઓફિસમાં હાજર થાય.

રજૂઆતોની અંતિમ તારીખ એપ્રિલ 27 છે અને સફળ અરજદારોને મે મહિનાના પૂર્વાર્ધમાં જાણ કરાશે. જૂન 1 સુધીમાં પરમીટો જારી કરાશે અને તે જૂન 1થી 30 નવેમ્બર 2018 સુધી ઉજવાતી સીટીની બર્સિંગ સિઝન માટે પ્રમાણિત છે.

અરજદારો માટે દિશાનિર્દેશો:

- 16 વર્ષ અથવા વધુની ઉંમરના હોવા જોઈએ
- જૂથ દીઠ કલાકારોની સંખ્યા મહત્તમ ત્રણ હશે
- કલા દર્શન કરો ત્યારે પોતે જ ધ્વનિ નિયંત્રણ અને એમ્પ્લિફિકેશન વગેરે પૂરું પાડવાનું રહેશે
- તમામ કાર્યક્રમો સામાન્ય પારિવારિક દર્શકો માટે ઉચિત હોવા જોઈએ

આ વર્ષે નવું એ છે કે લાયકાત ધરાવતા નટો અને કલાકારોને પસંદ કરવામાં આવેલ ટ્રાન્સિટ ટર્મિનલો પર કલા દર્શન માટે નિમંત્રિત કરાશે જેથી રોજિંદા પ્રવાસી માટે જીવંત ક્ષણો પૂરી પાડી શકાય. કલાકારો આખા ઉનાળા દરમિયાન સીટીના જાહેર બજારોમાં પણ ગતિશીલતા પ્રદાન કરી શકશે.

બ્રેમ્પ્ટન ખાતે બર્સિંગ પર વધુ માહિતી માટે અહીં મુલાકાત લો www.brampton.ca/culture.

-30

બ્રામ્પ્ટનમાં મોટા પાયે ફેરફારો થઈ રહ્યાં છે. આપણે વેધક ધ્યાન કેન્દ્રિત કરતા ભવિષ્ય માટે તૈયાર સંસ્થા છીએ. આપણે આપણાં સમુદાયની વૃદ્ધિ જાણીએ છીએ, જુવાની અને વિવિધતા આપણને અલગ અલગ કરે છે. આપણે કેનેડાના નવીન શોધ કરતા સુપર કોરિડોરના કેન્દ્રમાં સ્થિત, રોકાણ પ્રોત્સાહક અને આપણી વૈશ્વિક સફળતા વિકસાવનાર છીએ. આપણે ગુંજ ઊઠતા શહેરી કેન્દ્રો વિકસાવીએ છીએ જે ધૂજતા નથી અને અહીં રહેતા અને કાર્યસ્ત લોકોમાં ગૌરવ વધારીએ છીએ. આપણે બ્રામ્પ્ટનને આગળ વધારી રહ્યાં છીએ જે તેને નવીનતમ, સર્વગ્રાહી અને જુસ્સામય શહેર બનાવે. અમને [Twitter](#) અને [Facebook](#) પર અનુસરો. www.brampton.ca પર વધુ માહિતી જાણો.

मीडिया संपर्क (MEDIA CONTACT)

नाटाली स्टोगडिल (Natalie Stogdill)

मीडिया कोडिनेटर (Media Coordinator)

सीटी ओफ् ब्राम्पटन (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca